



# પાશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ

## ગ્રાહક તકરાર નિવારણ ફોરમ

ઓનલ કચેરી, "વીજ સેવા સદન", ચાવડી ગેટ, ભાવનગર

CIN : U40102GJ2003SGC042908

e-mail: [forumbhavnagar.pgvc@gmail.com](mailto:forumbhavnagar.pgvc@gmail.com)

ક્રમાંક: બીજેડ/ફોરમ/૧૦૯/૧૮-૧૯/ ૪૪૩૫

તારીખ :

૧ OCT 2018

પ્રતિ,

શ્રી જેરાણા નરશીલાઈ એભલભાઈ,  
રામજી મંદિર સામે,  
મુ. કંટાસર,  
તા. મહુવા, જી. ભાવનગર.  
મો : ૯૯૭૯૬૩૫૨૭૭૪.

કેસ નં. ૧૦૯/૧૮-૧૯.

વિષય : ઘર વપરાશના વીજ કનેક્શનનો સર્વિસ વાયર બદલવા બ

સંદર્ભ : આપનો પત્ર તા : ૦૮.૦૯.૧૮

### શ્રદ્ધાળું છ જગ્યાની

માનનીય શ્રી,

આપશ્રીની, ઉપરોક્ત વિષયના સંદર્ભમાં આપના દવારા ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ, ભાવનગર સમક્ષ કરેલ રજૂઆતના સંદર્ભમાં ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ દવારા આપવામાં આવેલ ચુકાદો આ સાથે સામેલ છે.

આપશ્રીની જાણ સારુ.

(અમ. પી. સોલંકી)

કન્વીનર,

ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ  
પીજીવીસીએલ., ઓનલ કચેરી ભાવનગર.

૧૮

બિડાયાઃ— ઉપર મુજબ.

પ્રતિ: કાર્યપાલક ઈજનેરીશી,

પાશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ

વિભાગીય કચેરી, મહુવા.

..... ગુજરાત વિધુત નિયંત્રક આયોગના જાહેરનામા નં. ૨/૨૦૧૧ની કલમ નં. ૨.૫૨ મુજબ સદર હુકમનાં પાલન અંગે થયેલ કાર્યવાહીનો જરૂરી અહેવાલ અત્રેની ફોરમ કચેરીને ફરજીયાત પાઠવવાનો રહેશે.

નકલ રવાનાઃ—

૧) શ્રી અધિકારી ઈજનેર, પાશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભાવનગર.

૨) શ્રી નાયબ ઈજનેર, પાશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, પેટા વિભાગીય કચેરી, આર-૨ મહુવા.

...આપની જાણ તથા જરૂરી કાર્યવાહી અર્થે.



કન્વીનર,  
ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ  
પી.જી.વી.સી.એલ, ઝોનલ કચેરી,  
ભાવનગર.

ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ કેસ નં. ૧૦૬ /૧૮-૧૯ નો હુકમ

વાઈ ની તા. ૦૮.૦૮.૧૮ ની રજૂઆત અન્વયે તેમની ફરિયાદનું નિવારણ કરવા જણાવવામાં આવેલ. વાઈ શ્રી ખેરાળા નરશીલાઈ એભલભાઈ, મુ. કંટાસર, તા. મહુવા જી. ભાવનગર દ્વારા તેમના ઘર વપરાશના કનેક્શનનો સર્વિસ વાયર બદલવા બાબત ને લઇને તકરાર ઉભી થતા રજૂઆત કરેલ. જેની ફોરમ દ્વારા પત્ર અત્રેની કચેરીનો પત્ર નં બીવીએન્સી /ફોરમ/૧૦૬/૧૮-૧૯/૪૧૩૦ તા. ૧૫..૦૬.૧૮. શ્રી પ્રતિવાઈની કચેરીને યોગ્ય કરવા જાણ કરવમાં આવેલ.

વાઈની સદર ફરિયાદના અનુસંધાને જરૂરી તપાસ કરી પ્રતિવાઈની ગ્રામ્ય-૨ પેટા વિલાગીય કચેરીના નાયબ ઈજનેર દ્વારા વાઈની ફરિયાદને ધ્યાને લઈ તા. ૨૩.૦૬.૧૮ના રોજ ફરીવાર સ્થળ પર જઈ વાઈના ઘર વપરાશના કનેક્શનનો સર્વિસ વાયર બદલવા અંગેની જરૂરી કાર્યવાહી કરી આપેલ છે. આમ, વાઈની ફરિયાદનું સંતોષકારક રીતે નિરાકરણ કરવમાં આવેલ છે

આમ, પ્રતિવાઈ દ્વારા કરવમાં આવેલ કાર્યવાહી તથા વાઈ દ્વારા તેમના લેખિત પત્રથી થી પણ પ્રતિવાઈના નાયબ ઈજનેરને જણાવેલ છે કે તેઓની ફરિયાદનો સંતોષકારક નિકાલ થયેલ છે અને સુખદ નિરાકરણ કરવામાં આવેલ છે. અને હવે વાઈને કોઈ ફરિયાદ રહેતી નથી, આમ, હવે કોઈ કાર્યવાહી કરવાની રહેતી ન હોઈ તે મુજબ વાઈની સદર ફરિયાદનો નિકાલ કરવામાં આવેલ છે.

આમ છતાં વાઈને સદર હુકમ સામે વાંધો કે તકરાર હોય તો આ હુકમ મખ્ય દિવસ-૩૦ માં વિદ્યુત લોકપાલશ્રીની કચેરી, બ્લોક નં ૩, પોલીટેકનિક કમ્પાઉન્ડ, આંબાવાડી, અમદાવાદ સમક્ષ અપીલ કરી શકે છે.

(બી. જી. દવે)  
સ્વતંત્ર સભ્યશ્રી

તારીખ : ૨૮.૦૮.૧૮

૧૦૨૨૧૪૨  
(પી. એચ. માવાણી)  
ટેકનીકલ સભ્યશ્રી

(એમ. આર. વજરીયા)  
અધ્યક્ષશ્રી,  
ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ  
પ.ગુ.વિ.કું.લી.:ભાવનગર.

